



સ્વ. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી મુક્તિદર્શનસૂરિજી મહારાજનું  
**અંતિમ પ્રવચન**

સંપાદક

આચાર્યશ્રી વિજય મહાબોધિસૂરિ મહારાજ



આવૃત્તિ : પ્રથમ મૂલ્ય : સદ્વાંચન નકલ : ૩૦૦૦

પ્રાસિસ્થાન :

મુંબઈ :

મौલિકભાઈ મોઢી,  
૮૩/૮૪, રત્નજ્યોત ઇન્ડ. એસ્ટેટ, ઈલાર્ગોનાથાન બેન,  
વીલે-પાર્લે (વે.) મુંબઈ-૫૬. મો. ૯૮૨૦૫૦૭૨૦

સુરત :

કેતનભાઈ ડી. શાહ  
એ-૧૦૦૧, મેઘધનુષ એપાર્ટમેન્ટ, સરેલાવાડી  
ઘોડદોડ રોડ, સુરત.-૩૮૫૦૦૧. મો. ૯૮૨૫૬૫૦૬૦

અમદાવાદ :

હેમેન્ડ્રભાઈ શાહ  
'બુક્સેલ્ફ' ૧૬, સી.ટી. સેન્ટર,  
સ્વસ્થિક ચાર રસ્તા પાસે, નવરંગપુરા,  
અમદાવાદ. ફોન : ૯૮૨૫૦૬૧૮૩૦

મુદ્રક : કિરીટ ગ્રાફિક્સ : મો. ૯૮૯૮૪૬૦૦૮૧



## અધ્યાત્મની યાત્રાનો મહાયાત્રી



ભરૂચ જિલ્લાના પાલેજ ગામના વતની સુશ્રાવિકા શાંતાબેન પણાલાલને ત્યાં વિ. સં. ૨૦૦૫ના માગસર વદ-હના દિવસે ગતજન્મની યોગ-અધ્યાત્મની અધૂરી સાધનાનો વિકાસ કરવા મહેન્દ્રનો જન્મ થયો.

સહજવૈરાગી મહેન્દ્રએ સ્કૂલ-કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી વિ. સં. ૨૦૩૧ના ચૈત્ર વદ-એકમના મુંબઈ-લાલબાગ મધ્યે શાસન-પ્રભાવક પૂજય આચાર્યદિવ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરી મહારાજના વરદહસ્તે ચારિત્રજીવનનો સ્વીકાર કર્યો. મહેન્દ્રનું મુનિઅવસ્થાનું નામ પડ્યું... પૂ. મુનિશ્રી મુક્તિદર્શનવિજયજી મહારાજ.





મુનિજીવનના પ્રારંભિક વર્ષોમાં પ્રકરણ, કર્મગ્રંથ, ન્યાય આદિનો સઘન અભ્યાસ કરી મુનિશ્રીએ ચારિતજીવનના સાતમા વર્ષે વર્તમાન ગચ્છાવિપતિ, શ્રીપ્રેમભુવનભાનુ પહૃધર - પૂજ્ય આચાર્યદિવ શ્રીમદ્વિજ્ય જ્યઘોષસૂરીશ્વરજી મહારાજના ઉપ-નિષદ્ધમાં રહી આગમગ્રંથો અને છેદગ્રંથોનો વિશેષ બોધ મેળવ્યો. સાથે સાથે યોગ અને અધ્યાત્મના ગ્રંથોનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કર્યું. મુનિશ્રીની એ વિશેષતા હતી... કે જે પણ ગ્રંથોનું તેઓશ્રીએ અધ્યયન કર્યું.. તે દરેકની તેમણે સુંદર નોંધ કરી છે. નિશિથસૂત્ર વગેરેની એમણે કરેલી નોંધ આજે પણ અનેક જિશાસુ-ઓને ઉપયોગી બને છે.

યોગ્ય સમયે પૂજ્યોના આદેશથી મુનિશ્રી સ્વતંત્ર ચાતુર્માસ કરતા થયા. ચાતુર્માસ દરમિયાન શ્રોતાઓને ધર્મ પમાડવા માટે પ્રવચન એ જ એમનું મુખ્ય મિશન રહેતું, પ્રવચન એ જ એમનો મુખ્ય પ્રોજેક્ટ હતો. અધ્યાત્મની ઉચ્ચામાં ઉચ્ચી વાતોને માર્ગાનુસારીના દંદાંતો દ્વારા એટલી સરળ બનાવી દેતા... જેથી શ્રોતાઓને



અધરા પદાર્�ો પણ સુગ્રાહ્ય બનતા. એમના પ્રવચનોમાં શ્રોતાઓની સંખ્યા (કવોન્ટિટી) કરતા સમજ (કવોલિટી) મુખ્ય રહેતી. મધ્ય હોય ત્યાં મધમાખી બેંચાઈને આવી જાય તેમ સમજદાર શ્રોતાઓ મુંબઈ, સુરત, અમદાવાદ વગેરે શહેરોમાં પૂજયશ્રીનું જ્યાં પણ પ્રવચન હોય ત્યાં આકર્ષાઈને આવી જતા. જ્યાં સારા પ્રવચનકારોનો ઉત્સાહ પણ ઓસરી જાય એવા પ્રવચનક્ષેત્રે શુષ્ણ ગણાતા સંઘોમાં પણ પૂજયશ્રી મેદાન મારી જતા.

ત્રણ શિષ્યોના ગુરુપદે બિરાજમાન થયા બાદ પૂજયશ્રી વિ. સં. ૨૦૬૮ના કારતક સુદ ૧૦ના મંગળ દિવસે તૃતીયપદે બિરાજમાન થયા. ત્યારથી જૈન સંઘમાં તેઓશ્રી આધ્યાત્મિક પ્રવચનકાર પૂ. આચાર્યદિવ શ્રીમદ્વિજય મુક્તિદર્શનસૂરીશ્વરજી મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા.

વાણીમાં ભીઠાશ, સ્વભાવમાં નરમાશ, હદ્યમાં કરુણા, વ્યવહારથી અલિપ્તતા, પરપદાર્થની નિસ્પૃહતા વગેરે અનેક ગુણો જીવનભર માટે પૂજયશ્રીની ઓળખ બની રહ્યા.



ગમે તેવા કોલાહલની વચ્ચે પણ તેઓશ્રી આસાનીથી ધ્યાનમાં સરકી જતા. કલાકો સુધી પદ્માસન-સુખાસન મુદ્રામાં બેસી તેઓશ્રી ધ્યાન કરી શકતા. વિભાવદશાથી પર થઈ સ્વભાવદશા-સ્વરૂપરમણીતાને પામવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા.

વિ. સં. ૨૦૭૨નું અંતિમ ચાર્તુમાસ ઉમરા સંઘની અતિ આગ્રહભરી વિનંતીથી સૂરત - ઉમરામાં થયું. ચારે મહિના જિન-વાણીનો વરસાદ વરસ્યો. ઉમરા સંઘ પાવન થઈ ગયો. આગામી ચાતુર્માસ પણ સૂરત મુકામે નક્કી થયું હોઈ શેષકાળ સૂરતમાં જ પસાર કરવાની પૂજ્યશ્રીની ભાવના હતી. અલગ અલગ સંઘોમાં વિચરતા પૂજ્યશ્રી સરેલાવાડી પધાર્યા. પૂજ્યશ્રીના પ્રવચનો સરસ જામ્યા. આચારાંગસૂત્રના આધારે પ્રભુ વીરની સાધનાનું વર્ણન પૂજ્યશ્રીની અસરકારક શૈલીમાં સૂક્ષ્મતમ વિવેચન સાથે ચાલી રહ્યું હતું.

ફાગણ વદ ચોથનું પ્રવચન સ્વર્થતાપૂર્વક થયું. રાત્રે ૧૧.૦૮ કલાક સુધી જ્ઞાનધ્યાનમાં મળ્યા. ફાગણ વદ પાંચમના સવારે



સ્વાસ્થ્ય અસ્વસ્થ થતા મહાવીર હોસ્પિટલમાં ઓડમિટ કર્યા. ટ્રીટમેન્ટ શરૂ થઈ. એક વાગ્યા સુધી સારુ વર્તાતું હતું. બપોરે બે પદ્ધી કિટીકલ પોજીશન થઈ. ડૉક્ટરના પ્રયત્નો નિષ્ફળ ગયા. પૂજ્ય આચાર્યશ્રી કુલચંદ્રસૂરિમહારાજે અંતિમ નિર્યામણા કરાવી. બપોરે ૩.૧૦ મિનિટે એમનો આત્મા આગળની સાધનાની પૂર્તિ કરવા પરલોક ભણી ચાલી ગયો.

એમની અધૂરી સાધનાની જલ્દી પૂર્ણાંહુતિ થાય અને તેઓશ્રી અક્ષયસુખના ભોક્તા બને... એવી મંગળ કામના....



પૂજય આચાર્ય  
શ્રી મુક્તિદર્શનસૂરિજી  
મહારાજનો  
સંક્ષિપ્ત પરિચય

: જન્મ :

૨૦૦૫, માગસર વદ-૬, તા. ૨૧-૧૨-૧૯૪૮, વડોદરા

: દીક્ષા :

૨૦૩૧ ચૈત્ર વદ-૧, તા. ૨૬-૦૪-૧૯૭૫, મુંબઈ-લાલભાગ

: વડીદીક્ષા :

૩૦૩૧, વેશાખ સુદ-૩, તા. ૧૪-૦૪-૧૯૭૫, મુંબઈ-શ્રીપાલનગર

: ગણિ-પંન્યાસ :

૨૦૪૩ કારતક વદ-૬, ૨૦-૧૧-૧૯૯૭, પીડવાડા

: આચાર્ય :

૨૦૬૯, કારતક સુદ-૧૦, તા. ૨૩-૧૧-૨૦૧૨, અમદાવાદ-

જૈનનગર

: કાળધર્મ :

૨૦૭૩, ફાગાણ વદ-૫, તા. ૧૭-૦૩-૨૦૧૭, સરેલાવાડી, સુરત.



પ્રસ્તુત છે...  
પૂજ્યશ્રીનું અંતિમ પ્રવચન...  
આચારાંગસૂત્રના પ્રથમ શુતર્કધના પ્રથમ  
અધ્યયનના આધારે પૂજ્યશ્રીએ આપેલ આ  
પ્રવચન પ્રાય: અક્ષરશા: સંકલિત કરીને અતે  
રજૂ કરવામાં આવે છે. માટે વાચકોને એ રીતે  
જ વાંચવા વિનંતી છે.

વર્ષોથી જેઓએ પૂજ્યશ્રીના પ્રવચનોનું  
શ્રવણ કરેલ છે, તેઓ પૂજ્યશ્રીની શૈલીથી  
વાકેફ જ છે.

આશા છે....વાચકો પૂજ્યશ્રીના આ  
પ્રવચનને ખૂબ ધૂટે... અને આત્મકલ્યાણના  
પંથે આગળ વધે.

: પ્રવચન સ્થળ :

સરેલાવાડી, સુરત.

: પ્રવચન સમય :

સવારે ૮-૩૦ થી ૧૦-૩૦

# पण्या वीरा महावीरिं

-आचाराङ्गसूत्र : १ / १ / ३ / २०

- આ મોક્ષમાર્ગ ઘણા

વીર મહાત્માઓ વડે અનુસરાયેલ છે.



## અંતિમ પ્રવચન

ગઈકાલનું સૂત્ર જોયા પછીથી નવું સૂત્ર જોઈએ છીએ.

વીસમા સૂત્રમાં સુધર્મસ્વામી જંબૂસ્વામીને કહી રહ્યા છે, કે - હે જંબૂ ! હે જિજ્ઞાસુ જંબૂ ! પ્રભુ મહાવીર પરમાત્મા માર્ગમાં જતી વખતે પીડ પાછળ ફરીને કે આડી અવળી દણ્ણ કરીને ન જોતા. જે દિશામાં પોતાને જવાનું છે તે દિશામાં ઈર્યાસભિતિનો સંપૂર્ણ ઉપયોગ રાખીને ચાલતા. પોતાના નિભિતે પ્રમાદના યોગથી એક પણ જીવ ન મરે એવું પ્રભુનું કરુણાથી આર્દ્ર થયેલું અને વાત્સાટ્યથી ધબકતું હદય હતું. એટલે





12

જે ગોચરચયર્યાએ નીકળ્યા છે, ભિક્ષાચયર્ય માટે નીકળ્યા છે... તો ત્યાં ગોચરીપ્રમાણ દણ્ઠિ રાખીને પ્રભુ નીચું જોઈને જ ચાલતા હતા. પછી આજુ-બાજુમાં, આમ શું ચાલે છે, પાછળ શું ચાલે છે એ બધો ઉપયોગ પ્રભુ તે વખતે ત્યાં આગળ રાખતા ન હતા.

વળી બીજી વાત કરે છે - માર્ગ પર સીધી દણ્ઠિ રાખીને એક માત્ર ચાલવાની જ કિયા પ્રભુ કરતા હતા. તે વખતે વચ્ચે કાંઈ બોલતા ન હતા. આંદું અવળું જોતા ન હતા. તે કિયા વખતે વચ્ચે કોઈ બોલાવે અને ખાસ પ્રસંગ પડે... વિશેષજ્ઞ મૂકે છે, વચ્ચે કોઈ બોલાવે અને ખાસ પ્રસંગ પડે... ખાસ, તો જ અલ્પ બોલતા. નહીં તો પ્રાય: મૌન સેવી કેવળ પોતાના માર્ગ સામે જોઈને તે યત્નપૂર્વક ચાલતા હતા.

આનાથી આપણે એ જોવાનું છે કે પ્રભુનું જીવન સાધનાકાળમાં કેટલું બધું આત્માને અનુરૂપ હતું. ઉપયોગ સ્વરૂપને અનુલક્ષીને જે કિયા કરે એમાં પ્રભુ તત્ત્વ થઈ જતા હતા. શરૂઆતમાં કિયાકાળે કિયાનો ઉપયોગ હોય પણ પછી એમ કરતા કરતા કરતા, જ્યારે ઉપયોગની સઘનતા થવા માટે એટલે બહારની કિયા સહજ થાય અને ઉપયોગમાં

સ્વરૂપ પકડાયેલું રહે. શું ? આ મોક્ષનો માર્ગ છે કે તમારે ગમે તેમ કરીને ચોવીસે ય કલાક તમારું જે પોતાનું ઘર છે, તેમાં જ રહેવાનું છે.

આપણા આત્માનું ઘર આપણી વીતરાગતા છે. વીતરાગતા કહો કે પ્રેમ કહો... એ બે એક જ વસ્તુ છે. શું ? વીતરાગતા એટલે શું ? જે આત્મા વીતરાગ બન્યો તે એક આંખના પલકારામાં સર્વજ્ઞ બને છે. પછી એ પોતાના જ્ઞાનમાં - કેવળજ્ઞાનના એક સમયના પર્યાયમાં વિશ્વના તમામે તમામ જડ ચેતન પદાર્થોને એના સર્વકાળના સર્વપર્યાયો સહિત અભેદપણે સમાવી લે છે.

કેવળજ્ઞાન, વીતરાગતા એ પોતાના - પોતાની ભીતરમાં કોઈને બાકાત રાખતું નથી ! સમજાય છે ? પ્રેમ એ વ્યાપકતાને સૂચવે છે, કે જેમાં એના હૃદયમાંથી કોઈ પણ વ્યક્તિ બાદ કરી શકતી નથી. એટલે પ્રેમનો સંકોચ તે રાગ છે. અને રાગનો વિસ્તાર તે પ્રેમ છે.

રાગ વધતા વધતા વધતા તમે બધા પર કરતા જાવ... કરતા જાવ... કરતા જાવ... પછી કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રહે... આવો રાગ જ પ્રેમ બની જાય છે. અને પ્રેમમાં તમે મારા ને તારાના ભેદ પાડ્યા, સંકોચ કર્યો એટલે રાગ આવ્યો. સમજાય છે ?





‘વીતરાગતાની વિકૃતિ એ રાગ છે, અને રાગની વિકૃતિ દ્રેષ છે.’  
સમજાય છે ? એટલે તમને ખબર છે ? જીવને રાગમાં કાંઈક-કાંઈક  
સુખ દેખાય છે. દ્રેષમાં તો સુખ છે જ નહીં. ઘ્યાલ આવે છે ? રાગમાં  
કેવું સુખ છે તમને ? રાગમાં વિકૃત સુખ છે.

14

રાગ એ વીતરાગતાની વિકૃતિ છે. તો વિકૃતિમાં સુખ પણ વિકૃત  
જ હોય. એના માટે દશાંત આપું છું. એક માણસને તમે દુધપાક  
પીવડાવો. ઠાંસી ઠાંસીને પીવડાવો. અને પછી ઉલ્ટી કરે... તેમાં  
દુધપાકની મીઠાશાનો કાંઈક સ્વાદ આવે છે. શું ?

સભામાંથી : ઉલ્ટી કર્યા પછી પણ ?

આવે ને ? સ્વાદ શેનો આવે ? જે નાંખ્યું છે એનો. ભલે વિકૃત  
સ્વાદ છે. એના જેવું સંસારનું રાગ જનિત સુખ છે.

અને દ્રેષ એટલે એક માણસને સુદર્શન ઠાંસી ઠાંસીને પીવડાવો.  
અને પછી એની ઉલ્ટી કરાવો. એને શું સ્વાદ આવે ? કડવાશ. તો દ્રેષ  
આવો છે. શું ? એટલે હકીકતમાં રાગ અને દ્રેષમાંથી એકેયના પક્ષે  
જવા જેવું નથી. બત્તેમાં સમ રહીને વીતરાગતાને સાધવા જેવી છે. શું ?

આ રાગ-દ્રેષ્ણની વચ્ચે સમ રહેવું એ આપણી પરીક્ષા છે. એ આપણી કસોટી છે. એમાં આપણે પાસ થવાનું છે. શું? જે વખતે જે આવ્યું, જેવું આવ્યું, જેટલું આવ્યું... એમાં કોઈ પણ પ્રકારનો વિકલ્યન ઉઠે અને સહજ રીતે તેનો ઉપયોગ કરાય તો જીવને વીતરાગતા નજદીક આવે. તમે એમાં કાંઈ પણ તમારું અંદરનું જજ્મેન્ટ આય્યું, તમારો અભિપ્રાય આય્યો, એટલે તમારા મતિજ્ઞાનમાં ચિત્રરામણ ઉભી કરી, ડહોળામણ ઉભું કર્યું.

બોલો, આજે આપણું એક તો કેવળજ્ઞાન મતિજ્ઞાન બન્યું. એટલે સમુદ્ર બિન્હુ બન્યું. સમજાય છે? સમુદ્ર ખાબોચીયું બન્યું. અને એ ખાબોચીયું પણ પાછું જો શુદ્ધ હોત તો પાણીની તૃપ્તા છીપાવી શકાત. પણ એ પાણી પણ ડહોળાયેલું છે. સમજાય છે કેમ? તો કે જીવ પાસે જેટલું મતિજ્ઞાન છે તે કેવળજ્ઞાનની અપેક્ષાએ ખાબોચીયું છે. અને એમાં પણ પાછા રાગ-દ્રેષ્ણના કચરાથી એ મતિજ્ઞાન ડહોળાયેલું છે. આવા મતિજ્ઞાનમાં શું સુખ હોય? મને કહો તો ખરા.

એક બાજુ પુણ્યના ઉદ્યથી કદાચ પદાર્થો મળે પણ અંદર ચિત્ર તો ડહોળાયેલું છે. તો ત્યાં સુખ ક્યાં છે? માટે જ્ઞાનીઓ કહે છે... આ





16

સંસારના પદાર્�ોમાં સુખ છે જ નહીં. તમારું ચિત્ત જેટલું સ્વસ્થ, જેટલું શાંત, જેટલું સ્થિર, જેટલું અક્રિય, જેટલું મૌન એટલું સુખ છે.

બોલો જરા... ઝુંપડપણીમાં રહેનારો પણ સુખ માણી શકે છે અને બંગલામાં રહેનારો પણ દુઃખ માણી શકે છે. સુખ અને દુઃખને વસ્તુ સાથે એટલો સંબંધ નથી જેટલો ચિત્તની વિશુદ્ધિ સાથે સંબંધ છે. શું? જેને ચિત્તની વિશુદ્ધિ થઈ હોય એને કોઈ પણ કાળે, કોઈ પણ ચીજ બધું બરાબર જ લાગે, પર્યામ જ લાગે, પુરતું જ લાગે. એને ક્યારે પણ પરપદાર્થની ન્યૂનતા, અપૂર્ણતા ખટકે જ નહીં. કારણ કે એને ખબર છે કે આનાથી હું સારી રીતે જીવી શકું એમ હું અને બીજા તરફ એ દણિ કરતો નથી. અને દણિ થાય તો સમાધાન કરે છે કે એના પુણ્યના ઉદ્યથી એને મળ્યું છે.

**સભામાંથી : બહુ કઠિન છે.**

એ જ શીખવું પડશે. અધ્યાત્મની નિશાળમાં બેસીને આ એકડો ધૂંતા જેને નહીં આવડે એ ભવોભવ સંસારમાં રખડશે. શું? એકલી કિયા કરીને જો મોક્ષ જવાતું હોત તો આ સંસાર આજે ખાલી થઈ ગયો હોત.. શું? કિયામાં સમજણ ભેળવો. પરમાત્માના વચ્ચનની શ્રદ્ધા ભેળવો.

તુકારામ શું કહે છે ? મહારાષ્ટ્રમાં થઈ ગયેલા સંત તુકારામ. એ શું કહે છે ખબર છે ? તારી દરેક કિયામાં વિકલનો મસાલો ભેળવ. તું જે કિયા કરે એમાં વિકલ વિકલ વિકલ વિકલ કર્યા કર. પછી કિયામાંથી તને આનંદ આવશે. એ કિયા તારી પ્રેમ સ્વરૂપ બની જશે. શું ? કિયાને કિયામાંથી પ્રેમ પ્રગટાવવાની તાકાત છે. પણ બધી જગ્યાએ સમજણ - શ્રદ્ધા આ બધું ભળતું જોઈએ. શું ? આજે શ્રદ્ધાની ખામી છે, સમજણની ખામી છે, પ્રેમ તત્ત્વની ખામી છે. કારણ કે હદ્યમાં વિશાળતા ને ઉદારતાના બીજ આપણે વાવ્યા જ નથી. કેવી રીતે આગળ વધીશું ? બોલો ! ખ્યાલ આવે છે ?

એટલે કહે છે કે, પ્રાય: મૌન સેવી કેવળ પોતાના માર્ગને સામે જોઈને પ્રભુ યત્નપૂર્વક ચાલતા હતા. આનાથી આપણાને આપણા જીવનમાં તારણ શું મળે ? આપણાને શું લાભ ? પ્રભુ તો આવું કરતા, એટલે કહો જે વખત પ્રભુ જે વખતે કિયા કરતા હતા એ વખતે ઉપયોગ તેમાં સ્થિર રાખતા હતા આ જૈનશાસનનો સિદ્ધાંત છે.

અનુયોગદાર કહે છે... કિયા જો ઉપયોગ પૂર્વક કરવામાં આવે તો એ કિયા ભાવકિયા કહેવાય. ‘અનુપયોગ દ્વયં’ આ શાસ્ત્રવચન છે.





ઉપયોગ વગરની કિયા એ મૃતકિયા છે. એ મડદાંની કિયા છે. એનાથી કાંઈ લાભ ન થાય એટલો. કારણ કે તમે ફિઝીકલી પ્રેરણ છો. મેન્ટલી એપ્સન્ટ છો. શું? અહીંયા તો જે કિયા કરો ત્યાં ફિઝીકલી અને મેન્ટલી બસે જગ્યાએ પ્રેરણ હોવું જોઈએ. શું? ખ્યાલ આવે છે?

બોલો વહેચા... એટલે કહે છે કે પ્રભુ એ કિયામાં ઉપયોગને લીન કરી દેતા હતા. એટલે તેમના ચિત્તની એકાગ્રતા અજોડ હતી. એની જોડ કોઈની સાથે મળે એવી નહોતી. શું? એ ફલિત થાય છે. અને બીજું એ કે - માર્ગ જતા અનેક પ્રકારના દર્શયો કે કારણ ઉપસ્થિત થાય અથવા પૂર્વના સંસ્કારના કારણો મનનું બેંચાણ થાય તો પણ પ્રભુ ત્યાં સંયમ જાળવતા હતા. સંયમ એટલે ડાફોળીયા નહીં મારવાના. આપણો ઉપયોગ ચંચળ બન્યો એટલે અસંયમ આવ્યું. શું?

સંયમ એટલે સારી રીતે યમ કરવો, નિયમન કરવો, કંદ્રોલમાં લેવું મનને. આ સંયમ આજે ચુકાઈ ગયો છે. પૂર્વ સંસારી જીવોમાં પણ સંયમ હતો. સંયમ એટલે શું ખબર છે? મન-વચન-કાયાની એકતા એનું નામ સંયમ કહેવાય. જેવું મનમાં વિચારો, એવું જ વાણીમાંથી નીકળે અને એવી જ કિયા કાયા કરે. શું? અત્યારે મન જુદું વિચારે,

વાણી જુદું બોલે, કાયા કાંઈ જુદું કરે એટલે કલિયુગમાં સંયમ દુર્લભ થઈ ચૂક્યો છે. શું ?

અને સંયમ વિના તો આ માર્ગ સાધી શકાય એવો છે જ નહીં. સંસારના બધા પ્રલોભનોમાંથી મન નીકળી જાય પછી જ સાચું સંયમ ઉદ્ઘયમાં આવે. બરાબર છે ? પ્રલોભનો ઉપર હત્થો મારતા શીખો... કે મારે આ સંસારમાં આ બધી ઉપાધિઓ છે. જેટલી વસ્તુ વધારે મળે ને એ બધી ઉપાધિ. બોલો જરા. ખ્યાલ આવે છે ?

સંસારમાં જે ચીજની જેટલી જરૂર છે એના કરતાં વધુ પડતી ચીજ મળે તો તે ઉપાધિ. શું ? અને જ્યાં ઉપાધિ હોય ત્યાં સંયમ ન હોય. ઉપાધિ હોય ત્યાં સંયમ હોય. ઉપાધિ હોય ત્યાં સંયમ ન હોય. બોલો જરા... બધી જગ્યાએ સમજો.

સભામાંથી : સાહેબ ! ઉપાધિ એટલે શું ?

ઉપાધિ એટલે આ અમારી ઉપાધિ કહેવાય. આ બધું ઉપાધિ કહેવાય. સંયમના આ સાધનભૂત ઉપકરણો એ ઉપાધિ અને એમાં મમત્વ અને જરૂરીયાત કરતા વધારે રાખવું એ ઉપાધિ ઉપાધિ થઈ ગઈ. શું સમજાય છે ?





20

સભામાંથી : જરૂરિયાત કેવી રીતે નક્કી કરવી ?

જરૂરિયાત આપણે નક્કી કરવાની કે આપણે કેટલું જોઈએ ? તમે નક્કી કરો કે તમારી પાસે કેટલી જોડ વખ્ત હોય તો તમે નજનતા વિના ફરી શકો. વખ્ત તો શરીરને ઢાંકવા માટે છે ને, ટાપટીપ કરવા માટે કે લોકોને દેખાડવા માટે થોડા છે ? કેટલાં જોઈએ ? બે જોડી, ચાર જોડી, છ જોડી બહુ થઈ ગયા. શું ?

એક કાળમાં તમારા જેવા ઉમરના - ઘરમાં રહેનારા લોકો પણ પોતાના કપડાં પોતાની જાતે ધોઈ કાઢતા હતા. ઘરમાં દીકરા હોય, એની પત્ની હોય, કામવાળી હોય... કાંઈ નહીં, આપણું કામ આપણે કરો. શું ? ચાર જોડી, છ જોડી કપડા રાખે. બે જોડી બહારગામ જવા માટેના અને બે જોડી અહીં બદલવા માટે.

સભામાંથી : આ તો સપનાની વાત થઈ સાહેબ !

શેનું સપનું ?

સભામાંથી : વૈભવ પ્રમાણે તો રહેવું પડે ને !

જો એક વાત સાંભળો, શાખકારોએ એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે જીવે પોતાના વૈભવને અનુસારે રહેવું. વૈભવને અનુસાર એટલે

શું ? કે સામાન્ય માણસ જે કપડાં પહેરતો હોય, તેના કરતા એ ઉંચી કોટીના પહેરે, એ વૈભવ કહેવાય. શું ? બીજા છ જોડી રાખતા હોય, એ આઈ-એસ જોડી રાખે. શું ? અને શ્રેષ્ઠ-ઉંચી કોટીના રાખે. પણ છાકટા બનીને જીવનું એ વૈભવ અનુસારે જીવનું એમ નથી. જો બહેનો બધી નક્કી કરી નાંખે અને આ ચીજ જો ધ્યાનમાં લે તો આજે એક એકની પાસે પચ્ચાસ જોડી કપડાં છે, સાંઈઠ જોડી, સીતેર જોડી, અંસી જોડી. આ પરિગ્રહ એમને મારી નાંખે એવો છે.

અમારે ત્યાં એક વખત અરીસામાં સાધુ મોહું જુવે ને તો સાત આયંગિલનું પ્રાયશ્ચિત્ત છે. શું ? અરિસામાં મોહું જુવે તો. તમે કેટલી વખત જોતા હશો ? જેટલી વખત તમે અરીસામાં મોં જુઓ એટલી વખત દેહનો રાગ પોસાય. એટલે રાગની પરિણાતિ જવલંત બને. શું ?

આપણે જ નક્કી કરવાનું છે કે ક્યાં ક્યાં હું પાપથી ખરડાઉં છું. અને એમાંથી મારે કેટલું બચી શકાય એવું છે. એ નિર્ણય તો આપણે જ કરવો પડે. શું ? આપણે જ્યાં સુધી સમજુ બનીને આપણી જત માટે નિર્ણય નહીં કરીએ, વિચારોએ નહીં તો બીજા કરશે કે કહેશે તેનાથી કાંઈ ફાયદો થવાનો નથી.





22

અંગુધી પરવાનગ

સભામાંથી : ના સમજણ હોય તેને પ્રાયશ્ચિત લાગે ?

સાંભળો તો ખરા. સુરેન્દ્રનગરમાં કાંતિ કોટન મીલવાળો એક વખત થઈ ગયો. એની પત્ની પહેલા મરી ગઈ. પછી બીજી પત્ની. હવે માણસ મોટી ઉમરે બીજી પત્ની પરણોલો હોય એટલે રાગ કેટલો હોય ! પેલો એને કહે તમે આ સાડી પહેરો અને આ સાડી પહેરો, પેલી બાઈ એટલી બધી સમજુ અને ચારિત્ર સંપત્ત હતી... કે નહીં, મારે તો સાદાં જ કપડાં જોઈએ. વ્હાઈટ એન્ડ બ્ઝાઈટ. શું ? એ કહે કે અમારું એક તો સ્ત્રી જીવન એ અતિ અતિ પાપના ઉદ્યથી મળેલું. પુરુષ વેદ કરતા સ્ત્રી વેદ અનંત ગુણી પાપરાશી ભેગી થાય ત્યારે મળે છે. અને એના કરતા અનંતગુણી પાપરાશી થાય ત્યારે નપુંસકવેદ મળે છે. પુરુષવેદમાં સ્વાધીનતા છે. સ્ત્રીવેદમાં પરાધીનતા છે. શું ? સમજાય છે ? સ્વાધીનતા જેવું જગતમાં સુખ નથી. પરાધીનતા જેવું દુઃખ નથી. એટલે પેલો ગમે તેટલો એને લાડ લડાવે, આ કહે કે મારે તો સાદાં જ કપડાં જોઈએ. એક તો અમારું સ્ત્રી જીવન અનંતા અનંત પાપથી ભરેલું અને એમાં અમે બધા આ નખરા અને ટાપટીપ કરીને પુરુષોને આંજુએ. અને

બીચારા અમારી પાછળ બ્રમરની જેમ રાગથી ચોંટે તો એ રાગના પાપમાં નિમિત્ત અમે બનીએ. તો અમારે કઈ નરકે જવાનું ?

આ વિચાર સમજુને આવે, ડાખાને આવે, વિવેકિને આવે. શું ? બેસે છે ? એટલે આપણા નિમિત્તે કોઈ આકર્ષાય, ખેંચાય, આપણાને જુએ અને પદ્ધી એને કામવાસના જાગે, વિકારો જાગે આ બધામાં આપણે નિમિત્ત બનીએ તો ભયંકર કોટીનું પાપ બંધાય. બબર છે કાંઈ ? બોલો ! હવે કેટલી જોડી કપડાં જોઈએ ?

એવી રીતે ખાવામાં કેટલી ચીજ જોઈએ ? બોલવામાં કેટલા શબ્દો જોઈએ ? જરૂર પડતા વધુ બોલો એ પણ વાણીનો પરિગ્રહ કહેવાય. શું ? આખા દિવસમાં કેટલું હુલન-ચલન જોઈએ ?

સભામાંથી : સાહેબ ! વાણીનો ઉપયોગ કેવી રીતે પરિગ્રહ ? વધારે બોલવું તે પરિગ્રહ ?

હાસ્તો. કોઈ પણ ચીજનો દુરૂપયોગ કરો એટલે પરિગ્રહ થઈ ગયો. જગતમાં જે કોઈ ચીજો છે એ આપણે સ્વ અને પરનો લાભ થાય એટલો જ ઉપયોગ કરવાનો છે. બાકી વધારે ઉપયોગ કરવાનો નથી. શું ? ઘ્યાલ આવે છે ? આજે બીજારુરી ઉપયોગ ભારતવર્ષના લોકો





24

કરવા માંડ્યા. બસો વર્ષ ધરતીમાં ચાલે એટલું પાણી હતું... એને ટ્યુબવેલ દ્વારા, બોર્ડિંગ દ્વારા, કુવાઓ દ્વારા ખેંચી-ખેંચીને કાઢી નાંખ્યું. આ કૃષાલેશ્યા છે. સમજાય છે ?

આજે પાણીનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે. તમારા સંડાસમાં તમે જઈને આવો અને પછી આમ કરીને સાકળ ખેંચો છો એ સાફ કરવા માટે આમ કરીને આમ ખેંચો એમાં કેટલી નાની બાલદી પાણી ચાલ્યું જાય એ ખબર છે ? સાત બાલદી જાય. અમારા ગામડામાં અમારા વડીલો જે પુરુષ હતા, એ જ્યાં સુધી શરીર સારું હતું ત્યાં સુધી જતા હતા. એક આટલો લોટો લઈને જાય. એમાં તો અશુચી સાફ થઈ જાય, હાથ-પગ સાફ થઈ જાય. બધું થઈ જાય. કેટલું જોઈએ ? આપણા પૂર્વજી શું કહેતા હતા કે ધી વધારે વપરાય તો ચાલે, પાણી ન વપરાય. શું ? જ્યાલ આવે છે ?

બધી વસ્તુમાં જરૂરીયાતનું નિયમન થઈ જાય. બોલવામાં, ચાલવામાં, હરવામાં, ફરવામાં, ઉઠવામાં, બેસવામાં, ખાવામાં, પીવામાં, જોવામાં, સાંભળવામાં... તો હમણા આત્મામાં ધરમ આવીને ઉભો રહે તેમ છે. શું ? પણ ધરમનો ક્યાં ખપ છે આપણને ?

આપણને ધર્મનો ખપ નથી. સમજાય છે ? એટલે કહે છે કે પ્રભુ સંયમ જળવતા હતા.

એટલે કે એકાગ્રતાના બાધક જે કારણો હતા એને શીત્ર દૂર કરી શકે એવા પ્રભુ સમર્થ શક્તિમાન. ઉપયોગને બીજે લઈ જ નહીં જવાનો. આ જૈનશાસનનો સિદ્ધાંત છે. જે વખતે જે કિયા કરો, એમાં એકાગ્ર બનીને રહો. સમજાય છે ?

મૂળ વિધિ શું છે કે જમવા બેઠા તો ઉપયોગ જમવામાં જ રાખવો. પછી તે વખતે સહૃદાબજારના કે શેરબજારના ભાવો શું ચાલે છે એમાં મગજ નહીં બગાડવાનું. અને માનો કે એ ચીજને તમે ચાવી-ચાવીને ખાવ...ખાવ...ખાવ... એ વખતે જે સ્વાદ આવે તો સ્વાદને પણ જુઓ. શું ? કે આ સ્વાદ એ પૌદ્રગલિક છે. અને હું ચેતન છું. અમારા બને વચ્ચે જુદાપણું છે. એટલે સ્વાદ જુદો - હું જુદો. સ્વાદ એ હું નહીં. હું એનો જાણનારો. આમ કરીને ભેદજ્ઞાન કરો. તો સ્વાદકાળે જે રાગ થાય તેનું પાપ ગૌણ થઈ જાય. અને પેલું ભેદજ્ઞાન કર્યું એની કિંમત વધી જાય.





એ કિયા કાળે એ જ કિયામાં ઉપયોગ ઘટી શકે. શું ? એ કિયાકાળે બીજુ કિયામાં ઉપયોગ લઈ જઈએ તો આ દોષ છે. આહાર કરતા તત્ત્વચિંતન નહીં કરવાનું. પણ જે ખાઓ છો એમાં ઉપયોગ રાખીને તમારી અંદરમાં શું કિયા ચાલી રહી છે, એમાં ઉપયોગને કોન્સન્ટ્રેટ કરવાનો. એ વખતે તમને ખબર પડે કે આ ચાવતા.... ચાવતા.... રાગ આવે છે તો તરી નહીં જવાનું... એ રાગ આવ્યો, રાગ આવ્યો. રાગ-બાગથી ઉરવાનું નહીં. આ રાગ છે. રાગને જુઓ. સમજાય છે ? કે આ જુદો ને હું જુદો. ભેદજ્ઞાન એ ધર્મનો પાયો છે.

26

ભેદજ્ઞાનથી ધર્મની શરૂઆત છે. તત્ત્વચિંતન એ સેંકડ નંબર છે. જાપ થર્ડ નંબર છે.

**સભામાંથી :** સાહેબ દહેરાસર જઈએ તો ચિત્ત આપણું ભગવાનમાં જ હોય પણ દહેરાસરમાં બોર્ડ પર લખાણ હોય તો તેમાં જીવ જાય કે નહીં ?

ક્યાં લખાણ લખ્યું હોય, દહેરાસરના બોર્ડ પર ? એ તમે જ્યારે પાછા ફરો દહેરાસરથી તમારી કભિલટ ભક્તિ કરીને, પદ્ધી તમારે વાંચવું હોય તો વાંચવાનું. નહીંતર નહીં વાંચવાનું. ચાલો....

તમે ધારો ને તો આજના કલિયુગના કલ્પવૃક્ષ થઈ શકો એમ છો. તમે કલ્પતરુ બની શકો એમ છો. પણ આપણી જાતે જ આપણે આપણી જાતને કંટકતરુ બનાવીએ છીએ. એને શું કરવાનું? શું? કોને આમાંથી મોક્ષે જવાની લગાની છે - એ તો મને કહો. બધાને સંસાર મજેથી ફાવી ગયો છે. કોઈને એવું લાગતું જ નથી કે મે આ સંસાર માંડ્યો એનો પશ્ચાત્તાપ હોય. એનાથી છૂટવાની તમના હોય. એને માટે પરમાત્માની ભક્તિ હોય, આજ્ઞા હોય, કાકલુદી હોય, પ્રાર્થના હોય... કે પ્રભુ છોડાવ મને, છોડાવ મને, હું ફસાઈ ગયો હું આ બંધનમાં.

તમને આ બધું બંધન લાગે છે? લગ્ન, પત્ની, દીકરા, દીકરી આ પૈસા-ટકાની જંજાળ અને ચોવીસ કલાક મગજને એમાં ફેરવ્યા કરવાનું. આ બધામાં કાંઈ ઉપાધિ દેખાય છે? આત્માનું નુકશાન દેખાય છે? બોલો !!

સભામાંથી : ફરજ દેખાય ને?

શું? ફરજ તો મોક્ષે જવાની છે. સંસારમાં રહેવાની ફરજ ક્યાં છે? અને ફરજ હોત તો ભગવાને આ બધાને ન ભજ્યા હોત?





ભગવાન શું કામ મોક્ષે ગયા ? જ્યાં અનંત સુખ છે તેને પામવું એ ફરજ છે. આને ફરજ કહેશો તો પછી આત્મામાં રમણતા કરીને મોક્ષે ક્યારે જવાશે ? અને આ ફરજ બજાવતા નરકાદિમાં જશો તો... ફરજ એટલી જ બજાવવાની કે જેનાથી આપણો આત્મા રાગ-દ્વેષથી ખરડાય નહીં. અને કાર્ય કરીને પાછો આત્મામાં આવી જાય. શું ? તો ફરજ કહેવાય.

સભામાંથી : આ કાળની અંદર તો કોઈ મોક્ષમાં જાય ખરું ?

28

અહીંયાથી નહીં જાય. ભરત અને ઐરાવતમાંથી આ કાળે મોક્ષે નહીં જવાય. પણ અહીંયાથી મનુષ્યમાં જઈને કેવળજ્ઞાન પામી શકાય. અથવા તો અહીંયાથી દેવલોકમાં જઈને મનુષ્યમાં આવી ત્યાંથી જઈ શકાય. શું ?

સભામાંથી : મોક્ષના દ્વાર ખુલ્લા છે ખરા ?

છે ને. ખુલ્લા જ કહેવાય. એક સીધી ટ્રેન આપણાને પાલિતાજ્ઞા ન લઈ જતી હોય, વાયા લઈ જતી હોય તો આપણે જઈએ કે ન જઈએ ? કોઈ એમ કહે કે એક ટ્રેન અમદાવાદ સુધી જશે. ત્યાંથી તમને

પાલિતાણાનો ઉભ્યો મળી જશે. આપણે એવા ગાંડા છીએ કે- નહીં, પાલિતાણા જતી હોય એ ટ્રેનમાં જવું છે. નહીં તો નથી જવું. એવા ગાંડપણ કરાય ?

અને બીજી વાત એ છે કે જેટલો તમને સમભાવ રહ્યો એટલો મોક્ષ અહીંયા જ છે. પેલા મોક્ષને શું કરવો છે ? પહેલા અહીંયા મોક્ષ પેદા કરો. શું ? અહીંયા આપણા શરીરના કોઈ ટુકડે ટુકડા કરે ને કાંઈ ન થાય તો આ મોક્ષ. બીજું શું ? સંસારની એક પણ ચીજની પર-આત્માએ નોંધ રાખવી નહીં અને એ પ્રસંગ બને એને સાંભળવું, વજન આપવાનું નહીં. શું ?

બોલો જોઈએ... સંસારની જે ઘટનાઓ બને એની નોંધ નહીં રાખવાની એક વાત. અને એને જરાય વજન નહીં આપવાનું. કોઈ નાનો છોકરો ગમે તેવું બોલે તમે તો ગાંડા છો ને આવા છો... આપણને કાંઈ થાય છે ? એની કોઈ નોંધ રાખીએ છીએ ? સમજ જઈએ. બુદ્ધિ ઓછી છે - બાળક છે. એમ જે કોઈ આવું કરે એને તમે આ ખાનામાં નાંખી દો. શું ? કેટલું સહેલું છે. મને કહો જરા.

સભામાંથી : સાહેબ ! અધરં છે. બહુ નફફટ થવું પડે.





કેમ નફફટ થવું પડે ? શું કામ નફફટ થવું પડે ? બાળક જેમ-તેમ બોલે તો આપણે કાંઈ કરીએ છીએ ? તો ત્યાં નફફટ થઈએ છીએ ? આખા સંસારને જ્ઞાનીઓએ પાગલખાનું કહ્યું છે. મેડાઉસ. ગાંડાઓના દવાખાના હોય છે ને તેમાં બધા ગાંડાઓ પોતાના કોચ પર બેસે, સુઈ જાય, નાચે, કુદે, હસે, રડે. પેલો ડોક્ટર વોર્ડમાં જોવા નીકળેલો હોય ને તેને ય તમારો મારી દે. ગાંડા માણસ કોને કહેવાય. તો ડોક્ટર એને મારે ? ડોક્ટર એને સાજો કરવા માટે નીકળ્યો છે. ઇતાં પેલા વોર્ડની અંદર ગાંડા હોય એ ડોક્ટરને ઠોકી દે તમાચ - તો ડોક્ટર 30 એને શું કરે ? સામે બે મારે ? હરામખોર ! તને એક તો સાજો કરું છું ને પાછો તું મને મારે છે ? એમ કહે ! સમજે કે બિચારો પાગલ છે. એના મગજનું ઠેકાણું નથી.

એમ આ સંસારમાં બધા જીવો એ વિવેકની ધરી પરથી ખસી ગયેલા છે. એટલે એને આ બધું મહત્વ આપવાના જ એ લોકો. ત્યારે આપણે એને ઢીલું મુકી દેવાનું. કોઈ બહુ ખેંચે ને ત્યારે આપણે છોડી દૃવું. આપણે છોડી દઈએ એટલે સામા માણસની પકડ ઓટોમેટિક ઓછી થઈ જાય. જેને જે જોઈએ છે ને તે તમે ઓછું વધતું આપીને

રાજી કરીને ચાલતા થઈ જાવ. શું ? ગાંડાઓની સામે જીદ ન કરાય, પકડ ન કરાય. એ ખોટો હોય તો એને ખોટો ન કહેવાય. એ ખોટો હોય તો એને સાચો જ કહેવાય. કારણ કે એ ગાંડો છે. એ ગાંડો હોય, ખોટો હોય ને તમે સાચો કહો તો શાંત થઈ જાય.

**સભામાંથી : સાહેબ ! ગાંડાની સામે અમે ય ગાંડા જ થયાને ?**

નહીં થવાનું. ગાંડાની સામે ગાંડા થાઓ છો એટલે સંસાર ચાલે છે. તમે બહારથી ગાંડા થાઓ, અંદરથી ડાખ્યા રહો. બહારથી ગાંડા એટલે શું ? બધું હા હા કર્યો કરવાનું. શું ? અંદરથી આપણાને જે ટીક લાગે તે કરવાનું. પણ ના શર્જ તો બહારથી બોલવાનો જ નહીં. કોઈની સાથે પણ. શું ?

**સભામાંથી : અંદર કાંઈ બીજું હોય અને બહાર બીજું કાંઈ હોય ચાલે ?**

‘ધર્મ માયા નો માયા.’ આપણો સ્વ-પરના હિત માટે કરીએ છીએ ને ? આશય શુદ્ધ છે ને ? પછી ક્યાંથી કર્મ બંધાય ? તો તમે જો આવું ન કરો ને એને ખોટો કહો તો સંઘર્ષ થાય. પછી મારા-મારી,





બોલાચાલી, હુંસા-તુંસી, વેર બાંધવું... એ બધામાં પડવું એના કરતા  
એક વખત હા કહીને છૂટી જવું શું ખોટું છે ?

સભામાંથી : કિયા ખોટી કરતો હોય તો એને કાંઈ કહેવાય કે ન  
કહેવાય ?

ગાંડા માણસને કશું કહેવાય જ નહીં. એ એક પહેલા સમજો તમે.  
આપણે તો આપણું જ જોવાનું. બીજા શું કરે છે એ બાબતમાં તમે છે ને  
આમ અહીંયા આગળ આંખે પાટા બાંધી દો અને કાને ડાબલા મુકી દો.  
એટલે તમને કશું સંભળાવું ન જોઈએ અને કશું દેખાવું ન જોઈએ.

32

સભામાંથી : આપણે સમજતા હોઈએ તો એને સંસારમાંથી  
બચાવી શકાય કે નહીં ?

હા, એ ગાંડા માણસોને પહેલા જોવાનું કે આપણે કહીશું તો  
સાંભળશે ? નથી સાંભળે એમ તો મૌન રહો. ખોટું કરતો હોય તો ને  
તો એ જેનું સાંભળે ને એના સુધી એને પહોંચવા દો. તમે વચ્ચે સીધા-  
ડાયરેક્ટ નહીં આવો. શું ? સુધારવા હોય ને તો આપણે પડા પાછળ  
રહીને કામ કરવાનું. ફેઈસ ટુ ફેઈસ સામે નહીં આવવાનું. ઘ્યાલ આવે  
છે ? તમારી પત્નીને તમારે ન બનતું હોય ને તો તમારી પત્ની તમારી

સાથે જઘડતી નથી. તમારી પત્ની મને કહી જાય છે કે સાહેબ ! એમને જરા કહેજો ને કે જરા આટલું સુધારે. આ માર્ગ કહેવાય. શું ?

પુષ્યશાળીના હાથમાં બધું જ છે. આ જગતનો સિદ્ધાંત શું છે, ખબર છે ? જે સત્યવાદી છે, જે તત્ત્વવાદી છે, જે તત્ત્વ તરફ ચાલી રહ્યો છે એની સામે જેમ ન પડાય, પડીએ તો આપણાને આત્મિક નુકશાન થાય. એમ જે ખોટો છે છતાં પુષ્યશાળી છે તો એની સામે ન પડાય. આજે મોદીની સામે પડાય ? તમે મને કહો, ચાલો. હું તમને પુછું છું... મોદી સાચું કરે છે કે ખોટું એ આપણા ભગવાન જાણો. આપણાને એની કંઈક વાતો નથી પણ બેસતી. મીટ એક્સપોર્ટ... બધું નથી બેસતું. તો પછી એની સામે પડાય ? ન પડાય ! એને એમ કહેવાય ? કે તમે ખોટા છો ! દુશ્મન ઉભા કરાય પછી તો. પુષ્યશાળીની સામે પડવું એટલે સૂર્યની સામે ધૂળ ઉડાડવી. એટલે કશું કરવા જેવું નથી. મૌન થવા જેવું છે. શું ?

તમે છે ને સવારથી-સાંજ સુધીમાં આત્મામાં એટલું જોઈ લો કે આજે કેટલું હું બીનજરૂરી બોલ્યો ? તે વખતે મારા ભાવ કેટલા બગડ્યા ? અને તે વખતે આટલા ઓછા શર્ષ્ટો બોલ્યો હોત તો ચાલે





34

એવું હતું કે નહીં ? આટહું જ તમે ખાલી ઓળખરવેશન કરો તો ધ્યાનું કામ થઈ જશે. કરવું છે ? જ્યાં વધારે પડતું બોલાઈ ત્યાં એટેટાઈમ ફીલ થવું જોઈએ કે આ ખોટું છે. એટલે શાંત થઈ જાવ. જ્યાં અધરું છે ? આમાં નથી પૈસા આપવાના, નથી મજૂરી કરવાની. બોલો જરા... નથી કોઈની ગુલામી કરવાની. શું અધરું છે ? મૌન રહેવું એ અધરું છે ? આ પ્રયોગ ધરમાં અને બહારમાં બધી જગ્યાએ અપનાવવા જેવો છે. સામો માણસ દસ વાક્ય બોલે ને ત્યારે આપણે અડધું વાક્ય જ બોલવાનું. ધરમાં પણ. ફાવશે ? પ્રયોગ કરશો ? તત્ત્વજ્ઞાન આમાંથી આવશે. બરાબર છે ? ચાલો....

આ પરથી એક ભાવ સહજ નીકળે છે કે એકાગ્ર સાધક જે કિયામાં તન્મય થાય એવી સ્થિતિ જ તેની એકાગ્રતાની સિદ્ધિનું પ્રમાણ છે. જે કિયામાં એકાગ્ર થાય તે સારી કિયામાં એકાગ્ર થાય. તેના ફળ રૂપે તેનું ફળ સારું જ મળે. કોઈકને મારવાની કિયામાં એકાગ્ર થાય તો તેનું ફળ ખરાબ પણ મળે. જે કિયામાં એકાગ્ર થાય એ કિયા જેવી હોય, એમાં એકાગ્રતાનો આશય જે પ્રકારનો હોય તે પ્રકારે એનું ફળ એને મળે છે. જે કિયામાં એકાગ્રતા હોય છે તેમાં હદ્ય અને બુદ્ધિ બનેના અંશો

જાગ્રત રહે છે. શું ? જે કિયામાં આપણે એકાગ્ર થઈએ તે કિયામાં આપણું હૃદય પણ જાગ્રત હોય તો તેનું શું કારણ છે ?

[તમારે અત્યારે આટલી બધી ઉતાવળ શું છે ? જિનવાણીના સમયે આવું બધું તમે કરો એ જિનવાણીની લઘુતા કહેવાય. અત્યારે તમારે સામાયિકની કિંમત નથી, જિનવાણીના શ્રવણની કિંમત છે. જિનવાણી શરૂ થાય તે પહેલા સામાયિક લઈ લેવાનું, પછી સામાયિક પુરું થાય ત્યારે નહિ, જિનવાણી પૂરી થાય પછી સામાયિક પારવાનું. વચ્ચે લેવાય નહીં, વચ્ચે પરાય નહીં. વચ્ચે કશું ન થાય. ખાલી તમારે ત્રાટક કરીને બેસવાનું. અને એક એક શર્દું સાંભળવાના નહીં, પીવાના.]

અધ્યાત્મ એ સાંભળવાનો વિષય નથી. પીવાનો અને ઘૂંટવાનો વિષય છે. કોઈ આપણને અમૃતના વિષયમાં સંભળાવે, અમૃત બહુ સારું તો આપણને શો લાભ થાય ? પણ અમૃત પીએ તો અને પીધા પછી એને અંદર-અંદર ઘૂંટ્યા કરીએ તો, લાભ થાય. તમે થોડુંક જ સાંભળો પણ પછી એને ચોવીસ કલ્લાક ઘૂંટ્યા કરો. આ ઘૂંટતા નથી ને એટલે આત્મા જાગતો નથી. તમે કેટલું સાંભળ્યું ? અત્યાર સુધી તમારા સાંભળવાનું પ્રમાણ કેટલું ? એમાં ઘૂંટ્યું કેટલું ? તો પણ તમને તો સારું





36

ફળ મળ્યું છે. તમને જે સારું ફળ મળ્યું છે એ તમે ધૂંટતા નથી એ તો નુકશાન છે એ છે જ. પણ પૂર્વભવના ઉપાદાન સારું લઈને આવ્યા છો, સંસ્કાર લઈને આવ્યા છો, એટલે જીવનમાં ખોટું થતું નથી એ લાભ છે.

જે પૂર્વભવમાંથી સારા સંસ્કાર ને સારું પોતાનું ઉપાદાન લઈને આવ્યા હોય એમને સહજ રીતે બધું ખોટું ફાવે નહીં, ખોટું થાય નહીં. અને સહજ રીતે બધું ઉચ્ચિત હોય તેમ થયા કરે એટલે જીવ ઘડા પાપથી બચી જાય. આને એક બાજુ ધૂંટો, અને બીજી બાજુ અંદર ચેકીંગ કરો કે શું ચાલે છે ? શું ચાલે છે ? ઓટોમેટિક રીજલ્ટ આવે જ. ક્યાં જાય ?

આ કોઈ દિવસ બને કે નેપાળાનો જુલાબ લે ને જાડો ન થાય ? આવું ત્રણ કાળમાં ન બને. નેપાળો એટલે છેલ્લામાં છેલ્લો ડોડ કહેવાય. લીધો છે કોઈએ ? લઈ જુઓ. એમ ભગવાને બતાવેલી વિવિધી આપણા જીવનમાં આચરણા કરીએ અને આપણાને એનું ફળ ન મળે એવું બને નહીં. કર્મ ભારે હોય તો બે-પાંચ વર્ષ, દસ વર્ષ રાહ જોવી પડે. પછી જ્યારે મળે ત્યારે ધનાધન એક સાથે બધું મળે. ચક્કવૃદ્ધિ વ્યાજ સાથે મળે. એટલે રાત અને દિવસ ધૂંટવાનો પ્રયોગ જોઈએ.

આખા એક કલાકના પ્રવચનમાંથી તમે એક જ વાક્ય બરાબર ચુંટી લ્યો. અને મારે આ વાક્ય અનુસાર જીવન જીવવું છે એવું નક્કી કરો. શ્રવણ પછી મનન, મનન પછી ચિંતન, ચિંતન પછી ધ્યાન, નિદિધ્યાસન અને પછી એમાંથી સમતા-સમાધિ આવે. અને એવી સમતા-સમાધિ વારંવાર આવે ત્યારે ઉપર ઉપરના ગુણસ્થાનકો ચડાય. પણ આ પ્રોસેસ તો આપણે કરતા નથી. કેમ ચાલશે ? શું કરવું છે ?

એટલે કહે છે કે તેમાં હૃદય ને બુદ્ધિ બનેના અંશો જાગ્રત રહે છે. આપણે જે કિયા કરીએ એમાં આપણું હૃદય બોલતું રહેવું જોઈએ. અને આપણી બુદ્ધિ પણ સજાગ રહેવી જોઈએ. જેથી કશું ખોટું થાય નહીં. સારું જ થાય. હૃદયના દ્વાર બંધ કરીને એકલી બુદ્ધિને ચલાવશો તો એટલું બધું ખોટું ધૂસી જરો કે જે લોકો એકલી બુદ્ધિથી જીવે છે અને બુદ્ધિના કલ્યા પ્રમાણે જીવે છે એમાં હૃદયનો તાર ભેળવતા નથી, એ આત્માઓને અંતિમ સમયે સમાધિ દુર્લભ થઈ જાય છે. સમાધિ એટલે મૃત્યુનું પરીક્ષા પેપર છે. સમાધિ એટલે મૃત્યુનું પરીક્ષાપત્ર. એમાં પ્રશ્નો પૂછાશો. તમારે એના જવાબ આપવાના રહેશો. તેમાંથી તમે જેટલા માર્ક પાસ થાવ એટલી સમાધિ કહેવાશે. શું ? અને પરલોકમાં જે ફળ મળે સદ્ગતિ. એ તેનું રીજલ્ટ કહેવાશે.





મૃત્યુ એ અંતિમ સમયે આવનારી કિયા છે. જેમાંથી કોઈ છટકી શકતો નથી. ચકવર્તિ હોય કે ઈન્ડ હોય. તમે ભૂગર્ભમાં ભરાઈ જવ તો પણ ન છટકી શકો. મૃત્યુના પંજામાંથી હજુ સુધીમાં કોઈ ઘૂટયું હોય એવું એક દણાંત જગતમાં છે નહીં.

તો ચોવીસ કલાક હદ્યથી જીવો. હદ્યથી જીવનારો કોઈને નુકશાન ન કરે. બધાને લાભ જ કરે. અને હદ્યથી જીવનારો દુર્ગતિમાં ન જાય, સહૃદગતિમાં જાય. અને દરેક ભવે હદ્યથી જીવે એ એક વખત મોક્ષે જાય. જો બુદ્ધિ બહુ ચાલે તો હદ્ય બંધ પડી જાય. અને હદ્ય જો બારાબર ચાલે તો બુદ્ધિ ઠપ થઈ જાય. તો આપણે બુદ્ધિને ઠપ કરવી છે, હદ્યને ચાલતું કરવું છે, બોલતું કરવું છે. જ્યાં ખોટું કરવાનો વખત આવે ત્યાં હદ્ય કહે કે આમ ન થાય, આમ ન થાય, આમ ન કરાય. આમ અંદર ટોર્ચરોંગ થયા જ કરે. એટલે જીવ ખોટું કરી શકે જ નહીં. આ સામાયિક છે, આ સમતા ભાવ છે.

અડતાલીસ મિનીટનું સામાયિક જો સાચું થાય અને એમાં સમતાભાવ સ્પર્શે તો પછી બાકીના ચોવીસ કલાકમાં એને વગર સામાયિકની કિયાએ સમતાભાવ સ્પર્શેલો રહે. એ ભાવથી સામાયિક

કહેવાય. જે જીવનભર કખાયોથી આત્માને બચાવે છે અને સમતા-ભાવમાં રહે છે એ સામાયિકમાં છે. સામાયિક એટલે સમભાવ. સમભાવથી ભાવિત આત્મા તે સામાયિક. સામાયિક અને આત્મા બને જુદી ચીજ નથી. આત્મા એ જ સામાયિક અને સામાયિક એ જ આત્મા.

એટલે જ્યાં સમભાવથી ભાવિત ચેતના નથી ત્યાં આત્મા નથી. તો ત્યાં શું છે? ત્યાં અનાત્મા છે. અનાત્મા એટલે જ્યાં જડ ભાવોનો સ્પર્શ રહે છે. શું? દોષોનો સ્પર્શ રહે છે. બુદ્ધિ આ ભવના લાભને જોઈને ચાલે છે. અને પછી જે કિયા કરો છો એમાં આત્મા નથી, અનાત્મા છે. આ બધાને જડ કહેવાય. આ ટોટલ જડ છે. સમભાવ એ આત્મા, એ વાસ્તવિક ચેતન. અને ચેતન હોતે છતે બુદ્ધિ દ્વારા ઉંઘું-ચતું કર્યી કરે એ અનાત્મા કહેવાય. એટલે ત્રણ ભેદ પાડ્યા : આત્મા, અનાત્મા અને જડ. તમે જડ પણ નથી આજે અને આત્મા પણ નથી. ત્રિશંકુ જેવી દશા છે.

સભામાંથી : સમભાવ નિર્મળબુદ્ધિથી ન આવે ?

આવે ને. નિર્મળબુદ્ધિથી આવે જ. પણ નિર્મળબુદ્ધિવાળાને કશું ખોટું ફાવે ? નિર્મળબુદ્ધિ આવે એટલે શાંત થઈ જાય. પછી કોની સાથે





બોલવાનું ? શું બોલવાનું ? પછી તો આત્મામાં જ રહેવાનું. આત્મામાં રહીશું તો જ મોક્ષે જઈ શકીશું. આટલું સમજાવી દો તમે. જેને આત્મામાં રહેતા આવડતું નથી એ બધા ભવો-ભવ રખે છે. શું ?

ધંધામાં ખોટ જાય તો બહુ ઉચ્ચા-નીચા ન થાવ. આત્માને સમાધાન કરો કે તને ખોટ ગઈ તો સામે કોઈકને લાભ થયો હશે કે નહીં ? તો ભલેને એ બિચારો સુખી થતો. આપણે શું કામ વ્યાપકભાવ, પ્રેમભાવ ન રાખવો ? હું એકલો જ સુખી થઉં અને આખું જગત દુઃખી રહે તો વાંધો નહીં. આ તો કૃષ્ણલેશ્યા છે.

40

સભામાંથી : આપણે ચૂકવવાના હોય ને.

આપણે એવો ધંધો નહીં કરવાનો. શું ? આપણી ઘરની મૂડી રોકીને જ ધંધો કરવાનો. એમાં જે મળે એ ખાવાનું. લોકોના પૈસા લઈને ધંધા કરવાના નહીં. શું ? એ ટેવ તમારે પાડવી પડશે.

જો આ જગતને સામે રાખીને જીવ્યા ને, તો તમારે ગમે ત્યારે દેવાળું કાઢવાનો વખત આવશે. નાદારી નોંધાવવાનો પ્રસંગ આવશે. કપડાં ખંખેરી નાંખશો. મારી પાસે કાંઈ નથી. આટલું છે, તમે વહેંચી લો બધા. પછી પાંચ પૈસા આવે કે દસ પૈસા આવે તમે જાણો. તમે એમ

માનો છો કે જે લોકો આ રીતે નાદારી નોંધાવે એને પરલોકમાં બધું પતી ગયું. તમે જેટલી લુચ્યાઈ કરીને આ ભવમાંથી નીકળ્યા છો એ બધું ચકવૃદ્ધિ વ્યાજ સાથે તમારે ભોગવવું પડશે. દેવાળું એટલે વિશ્વાસધાત અને વિશ્વાસધાત એટલે દુનિયાનું છેલ્લામાં છેલ્લું પાપ. વિશ્વાસ એ વિશ્વનો શાસ છે. એ શાસનું ગળું કેમ દબાવી દેવાય? આજે તમે ગમે તેટલી લખાણપણી કરો પણ સામો માણસ નક્કી કરે કે મારે નથી આપવા. તમને ગ્રાણ ગ્રાણ કોઈ સુધી રખડાવે અને છેલ્લે ય ન આપે તો કોઈ શું કરે. સાંધા કરો....આ કરો.... કરો તમારે...પેલો કહે કે મારી પાસે છે જ નહીં તો શું આપે? સમજાય છે? આજે કોઈ પણ માણસ ઉપર વિશ્વાસ મૂકી શકાય એવું છે નહીં. એટલે આપણા આત્માને બચાવવાનો ને લોકપરિયય વજર્ય કરવાનો છે. ઓછામાં સારું જીવન જીવવાનું. અને અહીંયાથી પરલોકમાં વિદાય થવાનું.

એકદમ બરાબર બેસી ગયું તમને? જો સાદું-સરળ-સંયમી-પવિત્ર-નિષ્ઠલંક જીવન જીવવાની ટેવ પાડી દો અને ઘરમાં બધાને આ પાઠ શીખવી દો તો તમે આજથી સુખી થઈ જાવ. અને જે તમારા ઘરમાં ના પાડે ને, તેને કહેવાનું કે તમે ઘરમાં રહો ને હું બહાર જાઉં છું.





42

આપણી સાચી વાત ઘરના લોકો ન માને તો આપણે તેને ઘરમાંથી કાઢવાના નહીં, આપણે ઘરની બહાર નીકળી જવાનું.

**સભામાંથી : સાહેબ આપણે સંયમ.....**

સંયમ નહીં લેવાનું. ચિંતા ન કરો. સંયમની વાત નથી કરતો અત્યારે. આપણે ઘરમાંથી નીકળીને શાંતિથી એક ખૂણો પકડી લેવાનો કોઈ જગ્યાએ. બેચ્ચાર કોથળા મજૂરી કરવી પડે તો કરી લેવાની. થોડા ચણા-મમરા આવે તો ખાઈ લેવાના. પાણી પી લેવાનું. કોઈ જગ્યાએ સૂઈ જવાનું. પણ એ વખતે તમને એમ થશે કે હાશ.

**સભામાંથી : સાહેબ ! આપણે બેગું કરેલું હોય એને કરવાનું શું ?**

અરે, આપણે બધું બેગું કરેલું મર્યાદા પછી ક્યાં આપણા હાથમાં આવે છે ? પેલું મર્યાદા પછી જતુ હતું, આ જીવતા ગયું. માથાફોડ મૂકો ને. તમે છે ને સમાધાન કરો. સમાધાન વિના સમતા રહેશે જ નહીં. મેં બેગું કરેલું, મેં બેગું કરેલું.... એ લઈ જાય. અરે ! એ લઈ જાય એનું પુઝ્ય છે. તું તારે આત્માને બચાવ ને ! પૈસાને શું કામ બચાવવા છે તારે ? અને તમારું પુઝ્ય હશે ને, તો બાર મહિનામાં એ દીકરાઓ પાછા આવશે. બાપા ભૂલ થઈ ગઈ. તમે કહેશો એમ કરીશું. પણ

આવો હવે તમે. આપણે આપણું પુછ્ય વધારવાનું છે. શુદ્ધિ વધારવાની છે. બરાબર છે !

સભામાંથી : અહીં તો બધું બરાબર લાગે છે. રીયલ તો કાંઈ થાતું જ નથી.

તમારે રીયલ કરવું પડશે.

સભામાંથી : સાહેબ ! આત્મામાં રહેવું એટલું શું ?

આત્મામાં રહેવું એટલે કષાયભાવથી અળગા રહેવું. સમમાં રહેવું.

ઇશુએ તેના અનુયાયીઓને શું કીધું છે, ખબર છે ? એક ઇશુના ભક્તે ઇશુને ફરિયાદ કરી કે મેં મારા શરૂને સાત વખત ક્ષમા આપી તો પણ તે મને હેરાન કર્યા કરે છે, તો મારે શું કરવું ? ઇશુ કહે કે - તારે સાત ગુણ્યા સીતેર વખત ક્ષમા આપવી. એનો ધર્મ તને હેરાન કરવાનો છે, તો તારો ધર્મ એને ક્ષમા આપવાનો છે. એ એનો ધર્મ નથી છોડતો તો તું શું કામ છોડે છે ? તું ક્ષમા આપતો જ રહે. યાદ રાખજો કે અંતે ક્ષમાનો વિજય થશે. કોધની હાર થશે.





સભામાંથી. : કોઈ જીવ કિયા કરે ત્યારે તે હદ્યથી કરે છે કે  
બુદ્ધિથી કરે છે તેનો ભેદ કેવી રીતે કરવાનો ?

એ તો તમારે અંદરમાં જોવાનું, તમારા આત્માને પૂછવાનું,  
તમારો આશય તપાસવાનો, તમારી રૂચિ જોવાની. બીજાને ભલે  
આપણે ન ઓળખી શકીએ પણ આપણી જાત માટે વિચારવાનું. અને  
બીજાને ખબર પડે કે આ માયા પ્રપંચ કરે છે તો આપણે તેને દૂરથી  
સલામ ભરીને છૂટા થઈ જવાનું.

44      હકીકત તો શું છે - તમે ઘરમાંથી નીકળી જશો ને તો તમને એટલી  
શાંતિ લાગશો, એટલી શાંતિ લાગશો કે ચાલો મોટા ભારખાનામાંથી  
છૂટ્યો.

સભામાંથી : તો આપણે નૈતિક જવાબદારી ભૂલી જવાની ?

કશું નહિ. માનતા નથી એની શું જવાબદારી ? જે આપણું માને  
નહીં એના પત્યે આપણી જવાબદારી શેની ? જેને આપણી સાચી વાત  
માનવી નથી એને કહી દેવાનું કે તો તમે રહો, હું જઉ છું. પણ  
તમારામાં એટલી હિંમત જોઈએ ને ?

સભામાંથી : એનો વિવેક પણ જોઈએ ને કે તે સાચું છે કે ખોટું છે.  
કોણી વાત ?

સભામાંથી : જે માણસ એમ કહે કે ધરના લોકો માનતા નથી.  
હા, એની સાચી વાત હોય તો જ. એમાં સ્વાર્થનો અંશ હોય તો ન  
ચાલે. ચાલો રાખીએ.... ચાલો.....



## પૂર્ણયના હસ્તાક્ષર

- લેખથી લોદમાં પ્રવર્તન = સંસાર  
અનેદથી અલોદમાં પ્રવર્તન = અદ્યાત્મ
- વ્યવહાર દર્મનું કાળ = બીજાના મિતનને પ્રસન્ન રહેણું.  
નિશ્ચયમ દર્મનું કાળ = સદા આત્મભલાય (નિર્ધિકલ્પ) માં લીન રહેણું.
- ભગવાનનું શાસન મપચા પદ્ધતિ દુઃખી રહ્યું  
અસરકાર છે.
- વ્યવહારમાં કરવાપણું, નિશ્ચયમાં ધ્વાપણું અને  
આત્મામાં હોવાપણું છે. Doing, Becoming, Being  
લીન જ એક્ષિશસ્ય કરેલ છે.
- પર્યાપ્તમાં વેરાગફેરિં નાચી તો નિશ્ચયદેણ્ટ કે  
દ્રવ્યદેણ્ટ સાચી નાચી.
- અદ્યાત્મમાર્ગમાં ડ્રિયાનું મૂલ્ય ૧%, લાવનું મૂલ્ય ૭%  
અને અશાયકાર્યનું મૂલ્ય ૭૦% છે. પરનું  
૧% વાળી ડ્રિયાશુદ્ધિ વગર ૭, વાળી લાલશુદ્ધિ થતી  
લાલી અને ૭૦% વાળી આશાયકાર્ય આવતી નાચી.
- ક્રમાંગો વચ્ચે પોદિન્ડ વીયારીને કુદા પડીએ છીએ  
પોદિન્ડ ઓદ ક્રું વિચારીએ તો દરેક મનને  
ઝાય ઝાયી શીક્યે.

## પજ્યના હસ્તાક્ષર

- આત્મભૂત જેરણું જોખે તરેણું મૈન
- આત્મા જ એક રાગાદ રૂપે પરિગમે છે. તે વીતરાગતાની હિસા છે.
- ગુફદાચાંદનુકમા વારે લિંગેશાત્મક અનિસા છે. ખેમ, મૈંગી, વાતસાંધ્ય એ લિંગેશાત્મક અનિસા છે.
- એ લીજાની લુણને લુણે એ મરેખર લૂલ કરતો નથી.
- મદ્ધયાદીનિને દેશાશારાદ્યક કણ્ણો છે જ્ઞાન સભ્યગ્રદીનને દેશાશિરાદ્યક કણ્ણો છે.
- સંતને પ્રતિકાર ન હોય માત્ર મણ રવીજાર હોય. ટેંક કૃષ્ણમાં સિથર ધાર તો નિમિત્તનો રવીજાર ધાર. એ જ મારોપુરબાઈ.
- ઈંડ - મઠીના પદ જેને એં લાગે તેને રવરૂપની મસ્તી થી ગઈ છે.
- લેદાયી વ્યાતા સંમારમાં લેદાદીચી જુવીએ ધીએ લાંઘી લાંઘેલાં લેદાદીએ છીએ.
- Overlook the event, but not book it and get hooked to it.



## પૂજયશ્રીની શિષ્ય સંપદા

પૂ. મુનિશ્રી સ્થિતપ્રકાવિજ્યજી મહારાજ

પૂ. મુનિશ્રી પ્રશમરિતવિજ્યજી મહારાજ

પૂ. મુનિશ્રી સોહંદશર્નવિજ્યજી મહારાજ

48

## પૂજયશ્રીની ગ્રંથ સંપદા

- નિજાનંદનો નિષ્કર્ષ
- યોગદાનાં અજવાળાં (ભાગ ૧-૨-૩)
- પરમપુરુષાયી આનંદધન પદરેહ (ભાગ : ૧-૨)
- હૃદય નયન નિહાળે જગધણી (ભાગ ૧-૨-૩)
- દેવચંદ્રજી પરાવાણી (ભાગ : ૧-૨)